



An ISO 9001, ISO 14001, ISO 45001 & ISO 50001 Certified Company

**Gujarat Narmada Valley  
Fertilizers & Chemicals Limited**  
CIN : L24110GJ1976PLC002903

P.O Narmadanagar - 392015, Dist. Bharuch, Gujarat, India  
Ph. (02642) 247001, 247002 Website: www.gnfc.in

NO. SEC/SE/Postal Ballot/Appointment/Chairman/Cost Auditor  
December 02, 2025

Dy. General Manager  
BSE Limited  
Corporate Relationship Dept.,  
1<sup>st</sup> Floor, New Trading Ring,  
Rotunda Bldg, PJ Tower,  
Dalal Street, Fort,  
Mumbai - 400 001  
Scrip Code: "500670"

Dy. General Manager  
Listing Department  
National Stock Exchange of India Limited  
Exchange Plaza,  
C-1, Block - "G",  
Bandra Kurla Complex, Bandra (E),  
Mumbai - 400 051  
Symbol: "GNFC"

Dear Sir / Madam,

Sub: Newspaper Publication - Compliance under Regulation 30 of the SEBI  
(LODR) Regulations, 2015.

-----

Pursuant to Regulation 30 of Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, please find enclosed the newspaper clippings of the Public Notice of Postal Ballot published on December 02, 2025 in the following newspapers:

1. Ahmedabad Edition of "Business Standard" and
2. Vadodara Edition of "Loksatta Jansatta".

The above newspaper clippings may also be accessed on the website of the Company [www.gnfc.in](http://www.gnfc.in).

You are requested to take note of the above.

Thanking you.

Yours faithfully,

For Gujarat Narmada Valley Fertilizers & Chemicals Limited

Rajesh Pillai  
Company Secretary & Compliance Officer

Encl.: As above



## SHIVAM AUTOTECH LIMITED

CIN: L34300HR2005PLC081531

**Registered Office:** 10, 1<sup>st</sup> Floor, Tower-A, Emaar Digital Greens, Sector-61,  
Golf Course Extension Road, Gurugram, Haryana-122102 Tel: 0124-4698700; Fax: 0124-4698798  
Email id: [info@shivamautotech.com](mailto:info@shivamautotech.com); Website: [www.shivamautotech.com](http://www.shivamautotech.com)

### NOTICE OF POSTAL BALLOT AND REMOTE E-VOTING INFORMATION

NOTICE is hereby given pursuant to Section 110 read with Section 108 of the Companies Act, 2013, the applicable Rules, Regulation 44 of the SEBI Listing Regulations, and SS-2, that the Company is seeking approval of the members for the special business set out below, by way of Postal Ballot through remote e-voting. The Postal Ballot process shall be conducted in accordance with the applicable MCA Circulars, and members are requested to cast their votes electronically within the prescribed timeline.

S. No.	Types of Resolutions	Resolutions
1.	Special	To consider and approve the issuance of unlisted, secured, redeemable, optionally convertible debentures on a preferential basis.
	Special	To consider and accord consent for offer, issue and allotment of equity shares through a Qualified Institutional Placement pursuant to section 42, 62 and all other applicable provisions of the companies act, 2013 and other applicable laws.
2.	Special	Approval for grant of special rights pursuant to OCD subscription agreement to alpha alternative structured credit opportunities fund.
3.	Special	To consider and approve the amendments to the articles of association of the company.
4.	Special	To consider revision in the borrowings limits under sections 180(1)(a) of the companies act, 2013
5.	Special	To consider revision in the borrowings limits under sections 180(1)(c) of the companies act, 2013

The Notice of Postal Ballot ('Notice') is available on the website of the Company at [www.shivamautotech.com](http://www.shivamautotech.com), on the websites of the Stock Exchanges viz. BSE Limited ('BSE') and The National Stock Exchange of India Limited ('NSE') at [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com), respectively. A copy of same is also available on the website of NSDL at [www.evoting.nsdl.com](http://www.evoting.nsdl.com).

In compliance with the aforesaid MCA Circulars, the Company has sent the Notice on Monday, December 01, 2025 only in electronic form to those Members whose names appeared in the Register of Members/List of Beneficial Owners as received from MCS Share Transfer Agent Limited, the Company's Registrar and Transfer Agent ('RTA') / Depositories as on Friday, November 28, 2025 ('Cut-Off date') and whose email addresses are registered with the Company/ RTA / Depository Participants (in case of electronic shareholding) or who will register their email address in accordance with the process outlined in the Notice. Accordingly, physical copy of the Notice along with Postal Ballot Form and pre-paid business reply envelope has not been sent to the Members for this Postal Ballot.

The Company has engaged the services of NSDL to provide remote e-voting facility to its Members and the communication of assent or dissent of the Members would only take place through the remote e-voting system. The remote e-voting period commences on Tuesday, December 01, 2025 at 9:00 a.m. (IST) and shall end Wednesday, December 31, 2025 at 5:00 p.m. (IST). The remote e-voting module shall be disabled by NSDL thereafter and Members will not be allowed to vote electronically beyond the said date and time. Voting rights of the Members shall be in proportion to the shares held by them in the paid-up equity share capital of the Company as on Cut-off date. Once vote on a resolution is cast, the Member will not be able to change it subsequently. Only those Members whose names are recorded in the Register of Members of the Company or in the List of Beneficial Owners as on the Cut-off date will be entitled to cast their votes by remote e-voting.

In case you have any queries or issues regarding e-voting, you may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at [www.evotingindia.com](http://www.evotingindia.com) under help section or write an email to [evoting@nsdl.com](mailto:evoting@nsdl.com) or the grievances can be addressed to the Company Secretary at the registered office of the Company or at [cs@shivamautotech.com](mailto:cs@shivamautotech.com).

After completion of scrutiny of the votes cast, the Scrutinizer will submit his report to the Chairman of the Company or any other person authorized by him. The results of the Postal Ballot conducted through remote e-voting along with the Scrutinizer's Report will be made available on the website of the Company at [www.shivamautotech.com](http://www.shivamautotech.com), the website of NSDL [www.evoting.nsdl.com](http://www.evoting.nsdl.com) and communicated to BSE and NSE on their respective websites i.e. [www.bseindia.com](http://www.bseindia.com) and [www.nseindia.com](http://www.nseindia.com), where the ordinary shares of the Company are listed within the stipulated timelines. The results will also be placed on the Notice Board at the Registered Office of the Company.

For Shivam Autotech Limited

Sd/-

Shakti Kant Mahana

Company Secretary

Membership No. A69273

Place: Gurugram  
Date : December 01, 2025

**HDFC Bank Limited**  
Branch: HDFC House, Near Mithalkhali Six Roads, Navrangpura Ahmedabad-380009. Tel :- 079-66307000

**DEMAND NOTICE**

Under Section 13 (2) of the Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (Act) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002. Whereas the undersigned being the Authorised Officer of **HDFC Bank Limited** (erstwhile HDFC Limited having amalgamated with HDFC Bank Limited by virtue of a Scheme of Amalgamation approved by Hon'ble NCLT-Mumbai vide order dated 17th March 2023) (HDFC) under Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13 (2) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, issued Demand Notices under Section 13 (2) of the said Act, calling upon the Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) listed hereunder, to pay the amounts mentioned in the respective Demand Notices, within 60 days from the date of the respective Notice/s, as per details given below. The undersigned have, caused these Notices to be pasted on the premises of the last known respective addresses of the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s). Copies of the said Notices are available with the undersigned, and the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s), may, if they so desire, collect the respective copy from the undersigned on any working day during normal office hours. In connection with the above, Notice is hereby given, once again, to the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) to pay to **HDFC**, within 60 days from the date of publication of this Notice, the amounts indicated hereinbelow in their respective names, together with further interest as applicable according to the details mentioned in the said Demand Notices from the respective dates mentioned below in column (c) till the date of payment and / or realisation, read with the loan agreement and other documents/writings, if any, executed by the said Borrower(s). As security for due repayment of the loan, the following Secured Asset(s) have been mortgaged to **HDFC** by the said Borrower (s) respectively. Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) attention is invited to the provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available to redeem the secured assets.

Sr. No.	Name of Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s)	Total Outstanding Dues	Date of Demand Notice	Description of Secured Asset(s) /Immovable Property (ies)
(a)	(b)	(c)	(d)	(e)
1	MR. RAVAL NARASINH VARUBHAI (Borrower) MRS RAVAL BHAVANABEN NARSINHBHAI (Co-Borrower)	Rs. 6,88,075/-Rs. 5,64,166/-Rs. 4,29,898/-Rs. 30,950/-Rs. 41,120/- and Rs. 51,383/-respectively dues as on 30-Sep-25*	04-Nov-2025	UNIT-85 SHIVALIK HOMES, S NO 14/P/1, OPP SURAJ DAIRY, VIJAPUR- HIMMATNAGAR HIGHWAY, VIJAPUR, VIJAPURROAD, MAHESANA: 382870
2	MR. KHIMANI DEEPESH (Borrower) MRS KHIMANI KOMAL (Co-Borrower)	Rs. 21,77,950/-and Rs. 1,352/-respectively dues as on 30-Sep-25*	04-Nov-2025	FLAT-I/504, FLOOR-5 KARNAVATI ENCLAVE - BLOCK I, S NO 590/1, FP-56/1, TP:107(VASTRAL - RAMOL), OPP SHRINAGDIP-3, NR EXPRESS HIGHWAY, NR DOON SCHOOL, CTM, AHMEDABAD: 380008
3	MR. PATEL VIKAS KUMAR (Borrower) MRS PATEL NIKITA VIKASKUMAR (Co-Borrower)	Rs. 17,99,941/-, and Rs. 51,680/- respectively dues as on 30-Sep-25*	04-Nov-2025	FLAT NO. A/104, 1ST FLOOR SHINE SUPERB - BLOCK A, RS 103/2 TPS 65 FP 265, NR. SHAYONA TILAK RESIDENCY GOTA, GHATLODIA AHMEDABAD: 380061
4	MR. SADANSHIV DIPAK (Borrower)	Rs. 3,24,931/-dues as on 30-Sep-25*	04-Nov-2025	TENEMENT-530 TO 539/1 DISHA RESIDENCY, PLOT 530 TO 539, S NO 33/1, SHRI PANCHVATI NAGARI, VILLAGE- KUKMA, BHUJ: 370105
5	MR. SHEIKH NAJIM AZIZUL HAQUE (Borrower) MRS SHEKH NASIRA AZIZUL (Co-Borrower)	Rs. 10,15,329/- and Rs. 26,443/- respectively dues as on 30-Sep-25*	04-Nov-2025	UNIT-90+91+92/4, PLOT-90+91+92/4 BAPA DAYALU NAGAR-1 S NO 589 (OLD SURVEY NO. 393) TALUKA-BHUJ: 370001
6	MR. MAKWANA DEVENBHAI RAMESHBHAI (Borrower) MRS MAKWANA ZANKHANA DEVENBHAI (Co-Borrower)	Rs. 20,35,814/-and Rs. 31,901/-respectively dues as on 30-Sep-25*	04-Nov-2025	UNIT-18/B NEW AKHAND ANAND PLOT 60, S NO 250 P1/1, B/H MASTRAM MANDIR, CHITRA SIDSAR ROAD, BHAVNAGAR:364001
7	MR BAROT DINESHKUMAR (Borrower) Wife/Son/Daughter/ Husband of MRS BAROT SUSHILABEN [since deceased] And other known and unknown Legal Heir(s), Legal Representative(s), Successors and Assigns of MRS BAROT SUSHILABEN [since deceased] (Co-Borrower)	Rs. 11,34,282/-, Rs. 1,35,088/-and Rs. 54,390/-respectively dues as 30-Sep-25*	04-Nov-2025	UNIT-20 SHRI HARI BUNGLOWS, PLOT FP 133, S NO 72/2, NEAR SM PATEL SCHOOL ROAD, BAVLA, AHMEDABAD: 382220
8	MR. HETHVADIA ANAND ARJAN (Borrower) MRS HETHVADIA DEEPA ANAND (Co-Borrower)	Rs. 45,12,077/- and Rs. 1,58,737/- respectively dues as 30-Sep-25*	04-Nov-2025	DUPLEX-02 DIVYAM BUNGALOWS PLOT 520, DIVYAM BUNGALOWS PVT LTD, WARD NO. 5-A, ADIPUR, GANDHIDHAM: 370201
9	MR. SHEKH LATIF ALI (Borrower) MRS SHEKH MOMENABIBI LATIF ALI (Co-Borrower)	Rs. 11,39,982/-and Rs. 39,060/- respectively dues as 30-Sep-25*	04-Nov-2025	UNIT-98 ASHAPURA NAGAR, S NO 707/1 & 707/2, MAA ASHAPURA NAGAR, C.S NO. 835/98 & 835/99, C.S. WARD NO. 4, BHUJ: 370001
10	MR. TRIPATHI SATISH D (Borrower)	Rs. 5,64,203/- dues as 30-Sep-25*	04-Nov-2025	FLAT-E/309, FLOOR-3RD SANGANI RESIDENCY - BLOCK E PLOT 47/5+44/3, S NO 565+566/2 B/H SANGANI PLATINUM NAROL-ASLALI ROAD, AHMEDABAD: 382445
11	MR. JADEJA KRIPALSINH PRABHATSINH (Borrower)	Rs. 2,46,285/- dues as 30-Sep-25*	04-Nov-2025	UNIT NO. 136 PARSHVA RESIDENCY (PARSHVA-II), RS NO 53 PART-1, NR. AGA KHAN SCHOOL, BH. UMIYANAGAR, MUNDRRA, GANDHIDHAM: 370421

\*With further interest as applicable, incidental expenses, costs, charges etc incurred till the date of payment and / or realisation. If the said Borrowers shall fail to make payment to HDFC as aforesaid, then HDFC shall proceed against the above Secured Asset(s) / Immovable Property (ies) under Section 13 (4) of the said Act and the applicable Rules entirely at the risk of the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) as to the costs and consequences. The said Borrower (s) / Legal Heir(s) / Legal Representative(s) are prohibited under the said Act to transfer the aforesaid Secured Asset (s) / Immovable Property (ies), whether by way of sale, lease or otherwise without the prior written consent of HDFC. Any person who contravenes or abets contravention of the provisions of the Act or Rules made thereunder shall be liable for imprisonment and/or penalty as provided under the Act.

Date: 01.12.2025 Sd/-  
Place : Gujarat Authorised Officer,

Regd Office: HDFC Bank Ltd. HDF Bank House, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai-400013.  
CIN: L65920MH1994PLC080618 Website: [www.hdfcbank.com](http://www.hdfcbank.com)

## SUPPLIERS INVITED

We wish to procure various materials for packaging of milk & milk products e.g. Injection & Blow Molded, Thermoformed items, Plastic Crates/Pallets & Insulated boxes, Flexible laminates, nylon barrier Ghee Film, LDPE Liner & Shrink Film, Aluminum Foil, BOPP Tape, Printed PVC shrink sleeves, printed HDPE PL & multiwall paper bags, mono / ceka / Refill Cartons, Corrugated Box/Carton/Trays/Pads, Tin Containers, MS / Plastic Barrel, Glass bottle, Crown/Cap/lug cap, Wooden Stick & spoon, vegetable parchment paper etc. Various Material handling equipment (MHE) & storage solution, warehouse automation equipment are also required.

Various other items e.g. Annatto Butter Colour, Vitamins, Dahi Culture, Butterscotch Chikki, Flavour, Colour & Stabilizers for Dairy Products, Fruit pulp/compounds/preparations, DCP & Mineral Mixture, visibility & display materials like Banners, Posters, Dangles, T-shirts, Caps, Bags, Umbrella, Promotable & display racks, Gunny/Jute Bag, Veterinary Medicines, First Aid/Surgical items for veterinary application, liquid Nitrogen & LN2 containers, Wheat, Cattle feed raw materials & ingredients like DORB, Maize, Gaur meal, Rapeseed, R.P. Fine, Raw Rice Bran, Mycotoxin Binder, Analytical lab equipment for food & feed analysis, cleaning & sanitizing chemicals etc. and various refrigeration equipment e.g. Deep freezer, Cold Room, Visk Cooler, Push Cart with eutectic deep freezer etc. & vending machines are also required.

Reputed suppliers interested in supplying the above said items may please write to us at [purchase@amul.coop](mailto:purchase@amul.coop)



Amul



SAGAR

**HDFC Bank Limited**  
We understand your world Branch : 4<sup>th</sup> Floor, C Wing, Sheetal Westpark Imperia, Besides Alpha One Mall, Near Vastrapur Lake, Vastrapur, Ahmedabad, Gujarat- 380052

**POSSESSION NOTICE**

Whereas the Authorised Officer of HDFC Bank Limited (erstwhile HDFC Limited having amalgamated with HDFC Bank Limited by virtue of a Scheme of Amalgamation approved by Hon'ble NCLT-Mumbai vide order dated 17th March 2023) (HDFC), under the Securitisation And Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 ("said Act") and in exercise of powers conferred under Section 13 (2) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notices under Section 13 (2) of the said Act, calling upon the following borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) to pay the amounts mentioned against their respective names together with interest thereon at the applicable rates as mentioned in the said notices, within 60 days from the date of the said Notice/s, incidental expenses, costs, charges etc till the date of payment and / or realisation.

Sr. No.	Name of Borrower (s) / Legal Heir(s) and Legal Representative(s)	Outstanding Dues	Date of Demand Notice	Date of Possession	Description of Immovable Property (ies) / Secured Asset (s)
A	B	C	D	E	F
1	MR. DAVE NIRAVKUMAR PRAHLADBHAI (Borrower) MRS DAVE PRITIBEN NIRAVKUMAR (Co-Borrower)	Rs. 17,28,775/- dues as on 31-Jan-25*	06-MAR-2025	30-NOV-25 (Physical Possession)	FLAT-C/702, FLOOR-7TH, SIDDHI ELEGANT BLOCK-C S NO 458, TP-81, FP-87, B/H GAYATRI EXOTICA, OPP SUNDRAM FLORA, NEW T P SCHEME ROAD, LAMBHA, AHMEDABAD: 382405

\*With further interest as applicable, incidental expenses, costs, charges etc incurred till the date of payment and / or realisation. However, since the borrower/s / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove have failed to repay the amounts due, notice is hereby given to the borrower/s / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove in particular and to the public in general that the Authorised Officer/s of HDFC have taken physical possession of the immovable property (ies) / secured asset(s) described herein above in exercise of powers conferred on him/them under Section 13 (4) of the said Act read with Rule 8 of the said Rules on the dates mentioned above. The borrower(s) / Legal Heir(s) and Legal Representative(s) mentioned hereinabove in particular and the public in general are hereby cautioned not to deal with the aforesaid Immovable Property(ies) / Secured Asset(s) and any dealings with the said Immovable Property (ies) / Secured Asset(s) will be subject to the mortgage of HDFC. Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) attention is/are invited to the provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available to redeem the secured assets.

Copies of the Prachinama drawn and Inventory made are available with the undersigned, and the said Borrower(s) / Legal Heir(s) / Legal Representative(s) is / are requested to collect the respective copy from the undersigned on any working day during normal office hours.

Date : 01.12.2025 Sd/-  
Place : Ahmedabad Authorised Officer,

Regd Office: HDFC Bank Ltd. HDF Bank House, Senapati Bapat Marg, Lower Parel (West), Mumbai-400013. CIN: L65920MH1994PLC080618 Website: [www.hdfcbank.com](http://www.hdfcbank.com)

**Gujarat Narmada Valley Fertilizers and Chemicals Limited**  
Regd. Office: P.O.Narmadanagar - 392015, Dist.: Bharuch (Gujarat), INDIA  
CIN: L24110GJ1976PLC002903, Tel: 02642 247001, 247002,  
E-Mail: [investor@gnfc.in](mailto:investor@gnfc.in) Website: [www.gnfc.in](http://www.gnfc.in)

### NOTICE OF POSTAL BALLOT & REMOTE E-VOTING

NOTICE is hereby given to the members of Gujarat Narmada Valley Fertilizers & Chemicals Limited ('Company'), pursuant to Sections 108, 110 and other applicable provisions of the Companies Act, 2013 ('Act') (including any statutory modification or re-enactment thereof for the time being in force) read with the Rules 20 and 22 of the Companies (Management and Administration) Rules, 2014 ('Rules'), as amended and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ('Listing Regulations') (including any statutory modification or re-enactment thereof for the time being in force), Secretarial Standard on General Meetings issued by The Institute of Company Secretaries of India ('SS-2'), as amended, and in accordance with the guidelines prescribed by the Ministry of Corporate Affairs ('MCA') for holding general meetings/ conducting postal ballot process through e-voting vide its General Circulars ("MCA Circulars"), to transact the special businesses as set out hereunder by passing Ordinary Resolutions by way of postal ballot through remote electronic voting ('remote e-voting') only.

Description of Ordinary Resolutions
1. Appointment of Shri Manoj Kumar Das, IAS (DIN: 06530792) as a Director and Chairman of the Company.
2. Ratification of remuneration payable to Cost Auditor of the Company for the Financial Year 2025-26.

Members are hereby informed that:

- The Company has completed the dispatch of Notice through email to the members on Monday, December 01, 2025.
- This Notice is available on the website of the Company at [www.gnfc.in](http://www.gnfc.in), on the website of Stock Exchanges i.e. BSE Limited at <https://www.bseindia.com/> and National Stock Exchange of India Limited at <https://www.nseindia.com/> and also available on the website of KFin Technologies Limited ('KFin / RTA') at <https://evoting.kfintech.com>.
- The cut-off date for the purpose of ascertaining the eligibility of members to avail remote e-voting facility is Friday, November 28, 2025. Only those members whose names are appearing in the Register of members / List of beneficial owners as on the cut-off date shall be eligible to cast their votes through postal ballot by remote e-voting.
- Kindly note that the hard copies of notice, postal ballot form and prepaid business reply envelope have not been sent to the members. Hence, the members are required to communicate their assent or dissent only through the remote e-voting system. The Company has engaged the services of KFin for the purpose of providing remote e-voting facility to the Members.
- The detailed procedure / instructions on the process of remote e-voting are specified in the Notice.
- The e-voting facility will be available during the following period:

Commencement of remote e-voting	Wednesday, December 03, 2025 at 9:00 AM (IST)
End of remote e-voting	Thursday, January 01, 2026 at 5:00 P.M. (IST)

The remote e-voting will not be allowed beyond the aforesaid date and time and the remote e-voting module shall be forthwith disabled by KFin upon expiry of the aforesaid period. Once the vote on a resolution is cast by a member, no change will be allowed subsequently.

7. Manner of registering / updating e-mail address by members:

Physical holding	Members holding shares in physical mode, who have not registered / updated their e-mail address with the Company, are requested to submit their e-mail and other KYC details (Income-tax PAN, Postal address with PIN, mobile number, bank details, signature) in form ISR-1 and ISR-2 to RTA of the Company.
Demat holding	Members holding shares in dematerialised mode who have not registered their e-mail address with their Depository Participant(s) are requested to register / update their e-mail address with the Depository Participant(s) where they maintain their demat accounts.

8. The Company has appointed CS J. J. Gandhi, Practicing Company Secretary (FCS 3519 and CP No. 2515) to act as the Scrutinizer, to scrutinize the entire e-voting process in a fair and transparent manner. The Scrutinizer's decision on the validity of votes cast will be final.

9. The Results declared along with the Scrutinizer's Report shall be placed on the Company's website [www.gnfc.in](http://www.gnfc.in) and on the website of KFin <https://evoting.kfintech.com> immediately after the result is declared by the Chairman or any other person authorized by him and the same shall be communicated to the Stock Exchanges, where the Equity Shares of the Company are listed.

10. In case of any query on e-voting, Members may refer to the "Help" and "FAQs" sections / e-voting user manual available through a dropdown menu in the "Downloads" section of KFin's website for e-voting : <https://evoting.kfintech.com> or contact KFin as per the details given below:

KFin Technologies Limited  
Selenium Tower B, Plot 31-32,  
Gachibowli, Financial District,  
Nanakramguda, Hyderabad 500 032  
Toll-free Nos.: 1800-309-4001  
(from 9:00 a.m. IST to 6:00 p.m. IST on all working days)

For GUJARAT NARMADA VALLEY FERTILIZERS & CHEMICALS LIMITED

Place : Bharuch  
Date : December 01, 2025

Sd/-  
RAJESH PILLAI  
Company Secretary & Compliance Officer

**Bank of Baroda**  
Gothan Branch : Gothan Vasvari Road, Gothan, Surat, Gujarat-394130. E-Mail id: [gothan@bankofbaroda.com](mailto:gothan@bankofbaroda.com)

**POSSESSION NOTICE [SECTION 13(4)] (For Immovable property) [Under Rule-8(1) of Security Interest (Enforcement) Rules 2002.]**

Whereas, The undersigned being the authorized officer of the **Bank Of Baroda** under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice dated **20.09.2025** calling upon the borrower/mortgagor **Mr. Jayesh Nanubhai Rupareliya (borrower), Mr. Vikas Nanubhai Rupareliya And Mrs. Geetaben Nanubhai Rupareliya (Co-Borrower)** to repay the amount mentioned in the notice being **Rs. 33,28,986/- (Rupees Thirty Three Lakhs Twenty Eight Thousand Nine Hundred Eighty Six only Plus other charges and interest thereon within 60 days from the date of receipt of the said notice.** The borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken Possession of the property described herein below in exercise of powers conferred on him under sub-section (4) of section 13 of Act read with rule 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on this the day of **29<sup>th</sup> day of November of the year 2025.** The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

The borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of **Bank of Baroda**, for an amount of **Rs. 33,28,986/-** plus other charges & interest thereon,

**DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY**

All rights title and interest in property bearing plot no 161 {at site} and plot no B/3-184 (as per approved plan) and as per village form no 7/12 & k.J.P the said plot is identified as new R.S/block no 11-184/B/3 admeasuring built up area 45.44 sq.mtrs and adjoining land admeasuring 27.39 sq.mtrs total admeasuring 72.83 . Along with undivided proportionate share admeasuring 45.95 sq.mtrs in the land for road, C.O.P etc in the residential society which is known and named as "Shantiniketan Residency" and the whole society is situated on the non-agriculture land bearing new block no 11 admeasuring 25489 sq mtrs ( before amalgamation/consolidation the whole land was identified as (i) New block no 11 (old block no 2) and (ii) New block no 12 (old block no 8) of village Kathodara, Sub district: Kamrej, district, Surat. East: Adj. Gamtal, West : Adj. Road, North: Adj. plot/block no 11/183/B/3, South: Adj. plot/block no 11/185/B/3,

Date : 29/11/2025 Place : Surat Chief Manager, Authorised Officer, Bank of Baroda Gothan Branch.

**JM FINANCIAL LIMITED**  
Corporate Identity Number: L67120MH1986PLC038784  
Registered Office : 7<sup>th</sup> Floor, Cnergy, Appasahb Marathe Marg, Prabhadevi, Mumbai 400 025.  
Tel. No. : +91 22 6630 3030 • Fax: +91 22 6630 3223  
Website: [www.jmfi.com](http://www.jmfi.com) • Email: [ecomunication@jmfi.com](mailto:ecomunication@jmfi.com)

### NOTICE TO SHAREHOLDERS SPECIAL WINDOW FOR RE-LODGEMENT OF TRANSFER REQUESTS OF PHYSICAL SHARES (SEBI Circular No. SEBI/HO/MIRSD/MIRSD-PoD/PIC/IR/2025/97 dated July 2, 2025)

JM Financial Limited hereby informs its shareholders that, in accordance with SEBI's circular referred above, a special window has been opened for the for re-lodgement of transfer requests of physical shares.

This initiative aims to facilitate ease of investing and safeguard the rights of investors in respect of the securities purchased. The facility is specifically available for physical transfer deeds that were originally lodged prior to April 1, 2019 but were rejected, returned or not processed due to deficiencies in the documentation, procedural issues or otherwise.

**The special window for re-lodgement of physical share transfer requests, which commenced on July 7, 2025, is currently active and will remain open till January 6, 2026**

Eligible shareholders are requested to re-lodge their physical share transfer requests within the above mentioned period to the Company's Registrar and Transfer Agents, **KFin Technologies Limited, Unit: JM Financial Limited, Selenium Building, Tower-B, Plot No. 31 & 32, Financial District, Nanakramguda, Serilingampally, Hyderabad, Rangareddy, Telangana – 500032, Email: [einward.ns@kfintech.com](mailto:einward.ns@kfintech.com).**

This is the third publication issued by the Company in compliance with the SEBI circular.

For JM Financial Limited

Date: December 1, 2025 Hemant Pandya  
Place: Mumbai Company Secretary & Compliance Officer

**AUTHUM INVESTMENT & INFRASTRUCTURE LIMITED**  
CIN: L5109MH1982PLC319008  
Registered Address: 707, Raheja Centre, Free Press Journal Marg, Nariman Point, Mumbai - 400 021  
Corporate Office: 11th Floor, The Ruby, North-West Wing, Senapati Bapat Road, Dadar West, Mumbai - 400028  
Email: [secretarial@authum.com](mailto:secretarial@authum.com), Website: [www.authum.com](http://www.authum.com), Ph. No.: (022) 6747 2117

### POSTAL BALLOT NOTICE AND E-VOTING INFORMATION

Notice is hereby given that the Company has on December 01, 2025 sent the Postal Ballot Notice ("Notice") dated November 28, 2025, by e-mail, to all Members whose names appear in the Register of Members/List of Beneficial Owners, received from National Securities Depository Limited ("NSDL") and Central Depository Services (India) Limited ("CDSL"), as on Friday, November 28, 2025 ("Eligible Members") and whose e-mail IDs were available with the Company. A copy of the Notice is also available on the website of the Company at [www.authum.com](http://www.authum.com), the relevant section of the website of BSE Limited ("BSE") at [www.bseindia.com](http://www.bseindia.com), National Stock Exchange Limited ("NSE") at [www.nseindia.com](http://www.nseindia.com) and the website of the remote e-voting service providing agency to the Company viz. CDSL at [www.evotingindia.com](http://www.evotingindia.com). Members who do not receive the Notice may download the



